Date: 31st May 2024

To,

BSE Limited	National Stock Exchange Of India Limited
1st Floor, New Trading Ring,	Exchange Plaza, C-1, Block G,
Rotunda Building, P.J. Towers,	Bandra Kurla Complex,
Dalal Street, Fort, Mumbai-400001	Bandra (E), Mumbai – 400 051
Scrip Code: 500418	NSE Symbol: TOKYOPLAST

Sub: Intimation of Advertisement in Newspaper under Regulation 47 of SEBI (Listing Obligations Disclosures Requirements) Regulations, 2015 Ref: NSE – TOKYOPLAST

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligation and Disclosure Requirement) Regulation, 2015, we hereby enclose the copies of the advertisement given in the Newspaper with respect to the Audited Financial Results of the Company for the quarter and financial year ended March 31, 2024.

The said financials were reviewed by the Audit Committee and duly approved by the Board of Directors at its meeting held on Tuesday May 28, 2024. The advertisement is published in the following newspapers:

- 1) FREE PRESS JOURNAL
- 2) Janadesh

This is for your information and records.

Thanking you,

For Tokyo Plast International Limited

Swagata Indulkar Company Secretary

Place: Mumbai Date: 28.05.2024

Place : Mumbai Date : 29th May, 2024

PUBLIC NOTICE

Branch Office: ICICI Bank limited , Shal Tower, Plot No-23 New Rohtak Road Karol Bagh New Delhi- 110005

The following borrower/s have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). A notice was issued to them under Section 13 (2) of Securitisation and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act-2002 on their last known addresses, however it was not served and hence they are hereby notified by way of this public notice

ı	unu	and hence they are hereby hounce by way of this public house.						
	Sr. No.	Name of the Borrower/ Co-Borrower/ Guarantor/ (Loan Account Number) & Address	Property Address of Secured Asset/ Asset to be Enforced	Date of Notice Sent/ Outsta- nding as on Date of Notice	NPA Date			
	1.	Rajeev Kumar Singh, Maya Devi, Balaji Dham Colony, Near Ram Barat Ghar, Badaun Road, Bareilly- 243001, A/c:- LBBAR00006286449/ LBBAR00006286470/ LBBAR00006514495	Part of Khasra No.1189, Situated In Gram Kareli Tehsil & Distt. Bareilly Uttar Pradesh- 234001	25/04/2024 Rs. 20,17,248.11/- Rs. 10,08,363.11/- Rs. 43,628.36/-	03/02/ 2024			

The steps are being taken for substituted service of notice. The above borrower/s and/or their guarantors (as applicable) are advised to make the payments of outstanding within period of 60 days from the date o publication of this notice else further steps will be taken as per the provisions of Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002.

Date: May 30, 2024 Authorized Office **ICICI Bank Limited** Place: Ahmednagar, Mumba

SATYAM SILK MILLS LIMITED

Regd Office: 82, Maker Chambers III, 215, Nariman Point, Mumbai 40002 Tel.: 022 - 2204 2554 / 2204 7164 • Fax No.: 022 - 2204 1643 • Email: satyamsilkmill@gmail.com • Website: www.satyamsilkmill.com CIN: L17110MH2004PTC030725

EXTRACT OF STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER / YEAR ENDED 31ST MARCH, 2024.

Particulars	Quarter Ended 31.03.2024 (Unaudited)	Quarter Ended 31.12.2023 (Unaudited)	Quarter Ended 31.03.2023 (Unaudited)	Year Ended 31,03,2024 (Audited)	Year Ended 31.03.2023 (Audited)
Total Income from Operations	-	-	-	-	
Net Profit / (loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) ordinary activities after tax	10.45	33.04	8.60	91.88	(1.62)
Net Profit / (loss) for the period before tax after Exceptional and/or Extraordinary items)	10.45	33.04	8.60	91.88	(1.62)
Net Profit / (loss) for the period after tax after Exceptional and/or Extraordinary items)	7.80	23.78	4.80	68.73	(8.23)
Total Comprehensive Income for the period Comprising Profit/(loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	243.47	133.99	(94.89)	527.91	(147.65)
Equity Share Capital Earnings Per Share (of Rs. 10/- each) For continuing and discontinued operations)- Basic and Diluted	185.13 0.42	185.13 1.28	185.13 0.26	185.13 3.71	185.13 (0.54)

The above is an extract of the detailed format of Quarterly / Year ended 31.12.2023 Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 read with SEBI circular dated 5th July, 2016. The full format of the Quarterly Year ended Financial Results is available on the Stock Exchange website: BSE Limited (www.bseindia.com).

2) The above were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 29th May, 2024. For Satyam Silk Mills Limited

Rohitkumar Mishra Whole Time Director

🙏 AXIS BANK LTD.

Registered Office:- Axis Bank Limited, "Trishul", 3rd Floor, OppSamartheshwar Temple, Near Branch Address :- Axis Bank Ltd.3 rd Floor, Gigaplex, NPC — 1, TTC Industrial Area, Mugalsan Road, Airoli, Navi Mumbai — 400 708.

RULE 8 (1) POSSESSION NOTICE (For Immovable Property)

Whereas the Authorized Officer of Axis Bank Ltd, under Securitization & Reconstruction of Financial Assets and Enforcemen of Security Interest Act 2002(herein after referred as "said Act") & in exercise of powers conferred under Section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, has issued Demand Notice as mentioned below, under Sectior 13 (12) of the said Act, calling upon the concerned Borrowers/Guarantors/Mortgagors/Guarantors, as per details given below to repay the amounts mentioned in the respective Notices within 60 days from the date of the respective notice. The Concerned Borrowers / Guarantors / Mortgagors having failed to repay the respective due amounts, notices are hereby given to the Concerned Borrowers/Guarantors/Mortgagors/Guarantors in particular and the public in general that the undersigned has taken Physical Possession of the properties described herein below in exercise of powers conferred on him under Section 13 (4) of the said Act on the date mentioned below. The Concerned Borrowers/Co-borrowers/Guarantors/mortgagors in particular and the public in general are hereby cautioned not to deal with the concerned properties and any dealing with the said properties will be subject to the charge of Axis Bank Ltd for amounts mentioned below.

The borrower's attention is invited to provisions of sub – section (8) of section 13 of the Act, in respect of time available to

red	redeem the secured assets.					
Sr. No	Name / Address of the Borrowers/Co- borrowers/Mortgagors/Guarantors					
1.	1) RAVEENA DNYANESHWAR SHINDE, (Borrower /Mortgagor), 2) DNYANESHWAER KISAN SHINDE, (Co- Borrower/ Mortgagor/ Guarantor /GPOA) Loan Account. PHR057307658175	Rs 33,43 Thousan the amo further in costs, ch				
	SCHEDULE OF THE PROPERTY :- FLAT NO. 00	I, GROUN				

3,827/- (Rupees Thirty Three Lakh Forty Three 03.02.2023 nd Eight Hundred & Twenty Seven Only) being 27-05-2024 ount due as on 31.01.2023, together with interest thereon at the contractual rate plus all harges and expenses till date of payment.

ND FLOOR, "DATTA KRUPA APARTMENT" PLOT NO-120, SECTOR 19 C. VILLAGE, KOPER KHAIRNE, NAVI MUMBAI, THANE-400708 ADMEASURING AREA: - 338 SQ. FT. CARPET AREA.

Authorized Officer Date: 27-05-2024 Place: Thane



PRATAAP SNACKS LIMITED

Outstanding Amount (Rs.)

CIN: L15311MP2009PLC021746 Registered Office: Khasra No. 378/2, Nemawar Road,

Near Makrand House, Palda, Indore – 452020, Madhya Pradesh, India Tel: (+91 731) 243 9999 $\textbf{E-mail:} \underline{compliance of ficer@yellow diamond.in} \mid \textbf{Website:} \underline{www.yellow diamond.in}$

POSTAL BALLOT NOTICE

Shareholders of the Company are hereby informed that pursuant to provisions of Section 110 and other applicable provisions of the Companies Act, 2013, ("Act") and Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014. ("Rules"). Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, ("Listing Regulations") (including any statutory modification(s), amendment(s) or re-enactment(s) thereof, for the time being in force), General Circular Nos. 9/2023 dated 25° September, 2023, 11/2022 dated 28th December, 2022, 3/2022 dated 5th May, 2022, 20/2021 dated 8th December, 2021, 10/2021 dated 23rd June, 2021, 39/2020 dated 31st December, 2020, 33/2020 dated 28th September, 2020, 22/2020 dated 15th June, 2020, 20/2020 dated 5th May, 2020, 17/2020 dated 13th April, 2020 and 14/2020 dated 8th April, 2020 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), Secretarial Standard on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India a Postal Ballot Notice dated 20th May 2024 seeking approval of Members of Prataap Snacks Limited ("Company") on the resolutions as set out in the Postal Ballot Notice has been sent only through e-mail to those members whose e-mail addresses are registered with the Company or Registrar and Transfer Agent or with Depository (ies) and whose names appear in the Register of Members / list of beneficial owners as on the cut-off date i.e., Friday, 24th May, 2024. The Company has sent the Postal Ballot Notice through e-mail on Wednesdav. 29th Mav. 2024.

The Postal Ballot Notice is also available on the Company's website www.yellowdiamond.in, website of the Stock Exchanges where the equity shares of the Company are listed i.e. National Stock Exchange of India Limited at www.nseindia.com and BSE Limited at www.bseindia.com and on website of Central Depository Services (India)

Limited (CDSL) at https://www.evotingindia.com Pursuant to the provisions of Section 108 of the Act read with the Rules, the Listing Regulations and MCA Circulars, the manner of voting on the proposed resolutions is restricted only to e-voting i.e. by casting votes electronically instead of submitting physical postal ballot forms. The voting rights of the members shall be in proportion to their shares in the paid up equity share capital of the Company as on the cut-off date i.e. 24th May, 2024.

The Company has engaged the services of CDSL, the authorised e-voting agency to provide the e-voting facility, During the e-voting period, members of the Company holding shares either in physical form or dematerialised form as on the cut-off date i.e. Friday, 24th May, 2024 can cast their vote only through remote e-voting in respect of the resolutions as set out in the Postal Ballot Notice. A person who is not a member as on the cut-off date should treat this Postal Ballot Notice

The e-voting period begins on Thursday, 30th May, 2024 at 9:00 a.m. (IST) and ends on Friday, 28th June, 2024 at 5:00 p.m. (IST). The e-voting facility shall be disabled by CDSL for voting thereafter.

As per SEBI Circular dated 9th December, 2020 on e-voting facility provided by Listed Companies, e-voting process has been enabled for all the individual demat account holders, by way of single login credential, through their demat accounts / websites of Depositories / DPs in order to increase the efficiency of the voting process. Individual members are advised to update their mobile number and e-mail address with their respective DPs/RTA's in order to access e-voting facility. Detailed instructions for login methods of e-voting are provided in the Postal Ballot Notice,

Members, who wish to update or register their e-mail address, in case of demat holding, may please contact their Depository Participant (DP) and register their e-mail address, as per the process advised by their DP and in case of physical holding, may send Form ISR-1 dully filled and signed to KFin Technologies Limited, the Share Transfer Agent of the Company at einward.ris@kfintech.com. For more details, kindly contact our Share Transfer Agent, KFin Technologies Limited, Selenium Building, Tower - B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad - 500032, Telangana, India or send an e-mail to einward.ris@kfintech.com. The website of the Share Transfer Agent is https://www.kfintech.com.

The result of remote e-voting will be declared on or before Saturday, 29th June, 2024 at the Registered Office of the Company. The said result will be displayed at the Registered Office of the Company, will be intimated to the Stock Exchanges where the Company's equity shares are listed and shall also be displayed along with the Scrutinizer's Report on the Company's website www.yellowdiamond.in and on the website of CDSL https://www.evotingindia.com.

Members are requested to carefully read all the Notes set out in the Postal Ballot Notice and in particular instruction

If you have any queries or issues regarding e-voting from the CDSL e-voting System, you can write an e-mail to ≤ <u>helpdesk.evoting@cdslindia.com</u> or contact at toll free no. 1800 22 55 33.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an e-mail to helpdesk.evoting@cdslindia.com or call at toll free no. 1800 22 55 33. For Prataap Snacks Limited

Place: Indore Parag Gupta Date: 29th May, 2024 Company Secretary and Compliance Officer



CHORDIA FOOD PRODUCTS LIMITED Regd. Off: Plot No. 399 & 400, Survey No. 398, Village Sangvi-Shirwal, Tal. Khandala, Dist. Satara - 412 801.

CIN: L15995PN1982PLC026173 Contact no: 9130076856

Email Id: cs.cfpl@gmail.com Website: www.chordiafoods.com

EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED AND YEAR ENDED 31ST MARCH, 2024 Quarter ended

Sr No.	Particulars	on 31-03-2024	Ended 31-03-2024	quarter ended 31-03-2023
		(Audited)	(Audited)	(Audited)
1	Total Income from operations	77.92	322.73	72.04
2	Net Profit / (Loss) for the period (before tax, exceptional and/or extraordinary item)	23.90	102.59	3.48
3	Net Profit / (Loss) for the period before tax (after exceptional and/ or Extraordinary items)	23.90	102.59	3.48
4	Net Profit / (Loss) for the period after tax (after exceptional and/ or Extraordinary items)	20.28	79.75	2.72
5	Total comprehensive income for the period [(comprising profit / loss for the period (after tax) and other comprehensive income (after tax)]	20.28	79.75	2.72
6	Equity Share Capital	403.00	403.00	403.00
7	Reserves (excluding Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous year)	-	1050.70	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continued / discontinued operations) Basic / diluted (Rs.)	0.50	1.98	0.07

Note: 1)The above is an extract of the detailed format of the Audited Financial Results of M/s Chordia Food Products Limited for the Quarter ended and Year ended 31st March 2024 filed with BSE Ltd under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations 2015. The full format of the same are available on the website of BSE Ltd at www.bseindia.com and at Company's website at www.chordiafoods.com.

2) For detailed notes refer full financial results available on website

Place: Pune

Date: 29 May, 2024

For Chordia Food Products Ltd. Pradeep Chordia Chairman & Managing Director

Ipca Laboratories Limited

Regd. Office: 48, Kandivli Industrial Estate, Kandivli (W), Mumbai 400 067

CIN: L24239MH1949PLC007837

Tel: +91 22 6647 4444, E-mail: investors@ipca.com Website: www.ipca.com EXTRACT OF AUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED MARCH 31, 2024

Sr.	.		Quarter ended		Year ended		
No.	Particulars	March 31, 2024 Reviewed*	Dec 31, 2023 Reviewed	March 31, 2023 Reviewed*	March 31, 2024 Audited	March 31, 2023 Audited	
1	Total Income from operations	2,033.01	2,052.86	1,511.63	7,705.04	6,244.32	
2	Net Profit / (Loss) for the period	213.32	220.43	129.44	950.42	745.29	
	(before Tax, Exceptional and/or Extraordinary items)						
3	Net Profit / (Loss) for the period before tax	76.60	288.89	129.44	842.67	745.29	
	(after Exceptional and/or Extraordinary items)						
4	Net Profit / (Loss) for the period after tax, after Exceptional	59.59	179.88	76.52	547.35	471.32	
	and/or Extraordinary items, share of profit / (loss) of						
	associates and joint venture and non-controlling interests						
5	Total Comprehensive Income for the period	(7.15)	222.03	80.02	513.47	486.33	
	[Comprising Profit / (Loss) for the period (after tax)						
	and Other Comprehensive Income (after tax)]						
6	Equity Share Capital	25.37	25.37	25.37	25.37	25.37	
7	Other Equity (excluding revaluation reserve)	-	-	-	6,306.82	5,816.65	
8	Earnings per share of ₹ 1/- each (not annualised):						
	Basic / Diluted (Before exceptional items) (₹)	7.74	4.39	3.02	25.82	18.58	
	Basic / Diluted (After exceptional items) (₹)	2.35	7.09	3.02	21.57	18.58	

The above is an extract of the detailed format of the Consolidated Financial Results for the quarter and year ended on March 31 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation 2015. The full format of these Financial Results are available on the Stock Exchange websites (www.bseindia.com and www.nseindia.com) and on the website of the Company (www.ipca.com).

*The figures of the last guarter for the current year and for the previous year are the balancing figures between the audited figure in respect of the full financial year ended March 31, and unaudited year-to-date figures up to the third quarter ended December 31, which were subjected to limited review.

3	Additional information on Audited Standalone Financial Re		(₹ Crores)			
Sr. No.			Quarter ended		Year	ended
No.	Particulars	March 31, 2024 Reviewed*	Dec 31, 2023 Reviewed	March 31, 2023 Reviewed*	March 31, 2024 Audited	March 31, 2023 Audited
1	Total Income from operations	1,510.62	1,506.83	1,401.63	6,166.46	5,814.62
2	Profit before Tax	127.30	200.15	132.21	822.16	750.49
3	Profit after Tax	64.76	136.94	84.82	530.41	505.70

By Order of the Board For Ipca Laboratories Limite Premchand Godha **Executive Chairman** (DIN 00012691)

DEUTSCHE BANK AG

PUBLIC NOTICE - AUCTION CUM SALE OF PROPERTY

Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act. 2002

The undersigned is the Authorized Officer of M/s. Deutsche Bank AG, having one of its places of business at Nirlon Knowledge Park Goregaon East, Mumbai- 400 063 ("Deutsche Bank AG"), under the S Assets and Enforcement of Security Interest Act, 2002(The Act) and in exercise of powers conferred under section 13 (2) read with rule 9 of the Security Interest (Enforcement) Rules, 2002 (The Rules) issued demand notices dated 2nd August, 2023 calling upon the Borrower(s)/ Co-borrower(s) Dattatrava Suresh Chavan, Yogita Dattatrava Chavan and Yogs Logistics residing at Flat No 006 10th Floor, Stellar Mahavir Universe, Mahavir Universe Society Road, LBS Marg, Bhnadup (W), Mumbai – 400078 to repay the utstanding amount of Rs.1,16,56,879/- (Rupees One Crore Sixteen Lakhs Fifty Six Thousand Eight Hundred and Seventy Nine Only) as on 30/07/2023, and interest thereon within 60 days from the date of receipt of the said demand notice. The Borrowe having failed to repay the amount, notice is hereby given to the Borrower and the public in general that the undersigned has taker possession of the property mortgaged with the Bank, to recover the said outstanding amount, in exercise of powers conferred on mo under section 13(4) of the Act read with Rule 8 of the Rules.

ı						
	Sr.	Secured Property Address	Reserve Price	EMD	Auction Date	
	No. 1	All that Piece and Parcel of Flat No 1006 10th Floor Stellar Mahaviruniverse Mahavir Universe Society Road, LBS Marg, Bhnadup	Rs. 1,50,00,000/-	Rs. 15,00,000/-	16th July 2024	
ı		(W), Mumbai – 400078 admeasuring 57.25 Sq.mtr (carpet Area).				

Now, the public in general is hereby informed that the Property mentioned below would be sold by public auction on AS IS WHERE IS BASIS and AS IS WHAT IS BASIS on 16th July 2024 at 4 p.m., at Deutsche Bank AG, Nirlon Knowledge Park, B1, 2nd Floor, Goregi East, Mumbai-400 063 by inviting bids in the sealed envelope as per the procedure and the terms and conditions stated below

The particulars in respect of the Property have been stated to the best of the information and knowledge of the Bank, who shall however not be responsible for any error, misstatement or omission in the said particulars. The Tenderer(s) / Offerer(s) / Prospective Bidder/Purchaser(s) are therefore requested, in their own interest, to satisfy himself / themselves/ itself with regard to the Property before submitting the tenders. To the best of the Bank's knowledge, there are no encumbrances on the Property and Bank has th right of sale of Property in compliance with due process of law.

TERMS & CONDITIONS OF PUBLIC AUCTION:

Date : May 29, 2024

. The property can be inspected on 15th June 2024 between 11 am to 2 pm. The bids shall be submitted in a sealed envelope to the office o undersigned along with a Demand Draft/Pay Order of be Rs. 15,00,000/- ((Rupees Fifteen Lakhs Only) towards the Earnest Money Deposit ("EMD") favoring "M/s. Deutsche Bank AG" so as to reach the office of Deutsche Bank AG at, Nirlon Knowledge Park, B1, 2nd Floor, Goregaor East, Mumbai-400 063 on or before **16th July 2024 by 2 pm**. The earnest money deposit shall not carry any interest

2. Offers that are not duly filled up or offers unaccompanied by the EMD or received after the date and time prescribed herein will not be considered / treated as valid offers, and accordingly shall be rejected. No interest shall be payable on the EMD.

3. Along with bid form the proposed bidder shall also attach his/her identity proof, proof of residence (such as copy of the passpor election commission card, ration card driving license etc.) and a copy of the PAN card issued by the Income Tax department 4. On the date of sale, all the bids duly received would be opened and the bid of the highest bidder, provided it is above the reserve price

may be accepted by the Bank. However the bidders personally present at the auction site shall have the right to further enhance their bid price, subject to a minimum of Rs. 25,000/- (Rupees Twenty-Five Thousand Only) over the price offered by the highest bidder and the Bank shall have the right to accept such higher bid, upon confirmation of the sale by the Bank, the purchaser will be required to pay deposit of 25% (Twenty-Five Percent) of the sale price, after adjusting the earnest money deposit immediately with the undersigned.

5. The request for extension of time may be allowed by the Bank at its sole discretion subject to such terms and conditions as may be deemed fit and proper by him. The balance amount of the purchase price shall be paid by the purchaser to the Bank on or before the fifteenth day after confirmation of the sale of the Property or such extended period as may be agreed upon in writing by the parties. In default of payment of entire consideration within the stipulated time, the Bank shall be at liberty to forfeit the EMD and/or any othe payment made by the purchaser and proceed with re-auction of the Property. The defaulting purchaser shall forfeit all claims to the Property or to any part of the sum for which it may be subsequently sold.

6. All payments shall be made by the purchaser by means of the Demand Draft/Pay Order favoring "Deutsche Bank AG".

7. On receipt of the sale price in full, the Bank shall issue a Sale Certificate in favour of the Purchaser/his nominee and would handover the possession of the Property to the purchaser.

8. The said Immovable Property described in the Schedule herein above shall remain and be at the sole risk of the Purchaser in all respects including loss or damage by fire or theft or other accidents, and other risk from the date of the Confirmation of the sale by the undersigned Authorised Officer. The Purchaser shall not be entitled to annul the sale on any ground whatsoever.

. The Demand Draft/Pay Order deposited towards the EMD shall be returned to the unsuccessful bidders. 10. For all purposes, sale of the said property is strictly on "as is where basis what is". To the best of the knowledge and information of the

authorised officer of the Bank, no other encumbrances exist on the property 11. All expenses relating to Stamp Duty, Registration Charges, Transfer Charges and any other charges in respect of the Property shall be porne by the purchaser. All outgoings, i.e., Municipal Taxes, Maintenance / Society Charges, Electricity and water taxes, cess or any othe dues including over dues in respect of the Property shall be paid by the successful purchaser.

12. The Bank is not bound to accept the highest offer or any or all offers, and the Bank reserves its right to reject any or all bid(s) withou assigning any reasons

13. No person other than the bidders themselves or their duly authorised representative shall be allowed to participate in the sale

14. In case all the dues together with all costs, charges and expenses incurred by the Bank are tendered by the above-named Borrower a any time before the date fixed for sale of the property under Sec 13(8) of the Act, then the Property will not be sold, and all the bids received from the prospective bidders shall be returned to them without any liability/claim against the Bank. This Notice is also notice to the abovesaid Borrower under Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Diana Nadar, Authorized Officer - Deutsche Bank AG

Dated: 30th May 2024

Contact Numbers: 9820066613, 9619887707, 9152770607 9821600029, 022 7180 3167/3727/3077/3479

IDBI BANK LIMITED, Retail Recovery Department, 2nd Floor, Mittal Court, A/B/C- Wing, Nariman Point, umbai -400021, Tel. No. : 022-6127 9253 / 6127 9288/ 6127 9342. (T) IDBI BANK

APPENDIX IV [RULE 8(1)]

POSSESSION NOTICE (For Immovable Property) The undersigned being the authorised officer of IDBI Bank Limited under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of the powers conferred under Section 13(12) read with rule 3 of Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice, calling upon the borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of the receipt of the said notice.

The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken Possession of the property described herein below, in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002.

The borrowers attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the IDBI Bank Ltd for an amount mentioned below and interest and charges thereon.

Sr. No.	Name of the Borrower / Owner of the property/ Guarantor	Date of Demand Notice	Date of Symbolic Possession	Description of Property	Amount claimed in Demand notice (Rs.)
1	Sh. Santosh Sham Gaikwad	13.03.2024	27.05.2024	Flat No.302, Shreya Swapna Apartment, Belavali Road, Jadhav Colony, Badlapur West, Maharashtra-421503.	2977170/-
Place: Mumbai Date: 30-05-2024 Authorized Officer, ID				Sd/- DBI Bank Ltd	

TOKYO PLAST INTERNATIONAL LIMITED

REG. OFF.: Plot No. 363/1(1,2,3), Shree Ganesh Industrial Estate, Kachigam Road, Daman, Daman and Diu – 396210 TEL: + 91 22-61453300 / FAX: + 91 22-66914499 CIN: : L25209DD1992PLC009784 Website: www.tokyoplastint.in

Extract of Standalone Audited Financial Results for the Quarter and Year ended March 31, 2024

		STAND	ALONE	
	Quarte	er Ended	Year	Ended
Particulars	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
	Audited	Audited	Audited	Audited
Total income from operations	1696.25	1966.99	6636.61	7552.81
Net Profit for the period (before Tax, Exceptional				
and/or Extraordinary items)	6.98	119.37	128.36	76.76
Net Profit for the period before tax (after				
Exceptional and/or Extraordinary Items)	6.98	61.43	128.36	18.82
Net Profit for the period after tax (after				
Exceptional and/or Extraordinary items)	(6.18)	61.43	100.28	(12.45)
Equity Share Capital (FV of Rs. 10/- per share)	950.14	950.14	950.14	950.14
Reserves (excluding Revaluation Reserve as				
shown in the Balance Sheet)	-	-	5064.69	4938.22
Earnings Per Share				
Basic:	(0.07)	(0.32)	1.06	(0.13)
Diluted:	(0.07)	(0.32)	1.06	(0.13)
Notes: 1 The above regulte have been reviewed	by the Audit (ommittee and	l approved by	the Roard of

Directors at their respective meeting held on Tuesday, 28th May, 2024. 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEB Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly & Yearly Financial Results is available on the Stock Exchange websites www.nseindia.com & www.bseindia.com ar at the website of the Company www.tokyoplastint.in

> Sd/- Velji L. Shah Chairman & MI DIN No. 00007239

DEVINSU TRADING LIMITED

Regd Office: 82, Maker Chambers III, 215, Nariman Point, Mumbai 400021 Tel. No.: 022 - 2204 2554 / 2204 7164 • Email: devinsutrading@gmail.com CIN: L51900MH1985PLC036383 • Website: www.devinsutrading.com

STATEMENT OF AUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31ST MARCH, 2024

Particulars Ended Ended Ended 31.03.2024 31.03.2024 31.03.2023 Total Income from Operations Net Profit / (loss) for the period (before tax, Exceptional and/or Extraordinary items) 17.00 54.09 5.62 Net Profit / (loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items) 5.62 17.00 54.09 Net Profit / (loss) for the period after tax 1.99 (after Exceptional and/or Extraordinary items) 11.49 45.64 Total Comprehensive Income for the period [Comprising Profit/(loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)] 132.93 Equity Share Capital 50.00 50.00 50.00 Earnings Per Share (of Rs. 10/- each)
(For continuing and discontinued operations) 9.13 0.40 Basic and Diluted Other Equity excluding Revaluation Reserve

The above is an extract of the detailed format of Quarterly/yearly ended 31.03.2024 Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015 read with SEBI circular dated 5th July, 2016. The full format of the Quarterly/ Year ended Financial Results is available on the Stock Exchange website: BSE Limited

The above were reviewed by the Audit Co respective meetings held on 29th May 2024.

For For and on behalf of the Board of Directors Raian Sawant

Whole Time Directo (DIN-08562840)



Regd.office: 3rd Floor, Maker Chambers IV, 222, Nariman Point, Mumbai - 400 021.
Phone: 022-3555 5000. Email: investor.relations@ril.com
CIN: L17110MH1973PLC019786

- NOTICE -

NOTICE is hereby given that the following equity share certificates which were issued by the Company are stated to have been lost or misplaced. Adhering to the provisions of Section 124(6) of the Companies Act, 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016, as amended, the Company has already transferred to the Investor Education and Protection Fund (IEPF) Authority the equity shares comprised in these share certificates after following the necessary procedure. Consequently, these share certificates automatically stand cancelled and are non-negotiable.

Sr. No.	Folio No.	Name / Joint Names	No. of Shares	Certificate Nos. From - To	Distinctive Nos. From - To
1	56361201	S P Dwivedi	40	10782882-882	193217448-487
		Deepak Dwivedi	40	53318344-345	1248109355-394
		,	90	58355089-089	1620554793-882
			170	62281507-507	2191029669-838
		Total	340		

In accordance with Regulation 40 of the Securities and Exchange Board of India

in accordance with Regulation 40 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, transfer of equity shares of the Company in physical form is not permitted. In view of the above, the public is cautioned from purchasing or dealing with these equity share certificates/equity shares in any manner whatsoever. Any person(s) who has/have any claim in respect of the aforesaid equity shares/share certificates, should lodge such claim with the Company's Registrar and Transfer Agents viz. "KFin Technologies Limited", Selenium Tower B, Plot No. 31-32, Gachibowli, Financial District, Nanakramguda, Hyderabad - 500 032, within Seven (7) days from the date of publication of this notice, failing which, the Company will proceed to approve any claim for return of the above given equity shares from the IEPF Authority, as and when received from the registered holders/rightful claimants

Place: Mumbai Date: May 29, 2024 Savithri Parekh Company Secretary and Compliance Officer

SolutionKotak Mahindra Bank Limited istered Office: 27BKC, C-27, G-Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai- 400051 Branch Office: KOTAK MAHINDRA BANK LTD-5TH FLOOR, ADAMAS PLAZA, 166/16, CST ROAD, KALINA, SANTACRUZ (E) MUMBAI — 400098

Sale Notice For Sale Of Immovable Properties

E-auction Sale Notice For Sale Of Immovable Properties

E-auction Sale Notice For Sale Of Immovable Assets Under The Security Interest Act, 2002 Under Rule 8(5) Read With Proviso To Rule 9(1) Of The Security Interest (enforcement) Rule, 2002.

Subsequent To The Assignment Of Debt In Favour Of Kotak Mahindra Bank Limited By "Small Business Fincredit India Private Limited (hereinafter Referred To As "SBFC") the Authorised Officer Of Kotak Mahindra Bank Limited (hereinafter Referred To As "SBFC") the Authorised Officer Of Kotak Mahindra Bank Limited (hereinafter Referred To As "the Bank/ Kmbl/Secured Creditor) Has Taken Thephysical Possession Of Below Described Immovable Property (hereinafter Called The Secured Asset) Mortgaged/charged To The Secured Creditor On 02.03.2023.

Notice Is Herein Given To The Borrower (s) And Glugarator (s) In Particular And Public In General That

Asset working general get for the Sorrower (s) And Guarantor (s) In Particular And Public In General That The Bank Has Decided To Sale The Secured Asset Through E-auction Under The Provisions Of The Sarfaesi Act, 2002 On "as Is Where Is", "as Is What Is", And "whatever There Is" Basis For Recovery Of Sariads Act, 2002 Off as is winelers, as is winatar, And witaker inter is basis For Recovery Office.

Rs. 24,35,174,89-(Rupees Twenty Four Lakh Thirty Five Thousand One Hundred Seventy Four And Fifty Nine Paisa Only) Outstanding As On 28,05,2024 Along With Future Applicable Interest Till Realization, Under The Loan Account No. PR00393891; Loan Availed By Mr. Rakesh M. Tulaskar, Mr. Manish M. Tulaskar, Ms. Nilima R. Tulaskar & Mrs. Harshda M. Tulaskar As Per Below Details.

Date Of Auction	20.06.2024
Time Of Auction	Between 12:00 Pm To 1:00 Pm With Unlimited Extension Of 5 Minutes
Reserve Price	Rs. 10,00,000/- (Rupees Ten Lakh Only
Earnest Money Deposit (emd)	Rs. 1,00,000/- (Rupees One Lakh Only)
Last Date For Submission Of Emd With Kyc	19.06.2024 Up To 5:00 P.m. (IST)
Description Of The Secured Asset	All That Piece And Parcel Of Property Bearing Flat No.001, Ground Floor, Sadguru Krupa Apartment, Land Area Admeasuring 625 Sq.ft., Situated Al Belavali, Swapna Nagri, Badlapur (west), Tal. Ambernath, District Thane- 421503. Bounded As:east: 15 Ft. Road, West: Property Of Waman B. Gaikwad, North: Mr. Ware, South: Bearing Plot No.16.

Nil The Borrowers' Attention Is Invited To The Provisions Of Sub Section 8 Of Section 13, Of The Act, In Respect Of The Time Available, To Redeem The Secured Asset. Borrowers In Particular And Public In General May Please Take Notice That If In Case Auction Schedule

Of Sale Through Private Treaty. n Case Of Any Clarification/requirement Regarding Assets Under Sale, Bidder May Contact Mr. Agne Pillai (+91 8976929685), Mr. Gurpal Singh (+91 8976898212), Mr. Rupesh Pradip Pawar (+91 8097895337) & Mr. Rajender Dahiya (+91 8448264515). Bidder May Also Contact The Bank's Iv No. (+91-9152219751) For Clarifications.

erein Fails For Any Reason Whatsoever Then Secured Creditor May Enforce Security Interest By Way

https://www.kotak.com/en/bank-auctions.html | rovided In The Bank's Website I.e. www.kotak.com and/or On http://bankauctions.in

For Kotak Mahindra Bank Ltd., Authorized Office

For Detailed Terms And Conditions Of The Sale, Please Refer To The Lin

PLACE: BADLAPUR, THANE, DATE: 30-05-24

TOKYO PLAST INTERNATIONAL LIMITED

3

REG. OFF.: Plot No. 363/1(1,2,3), Shree Ganesh Industrial Estate, Kachigam Road, Daman, Daman and Diu – 396210 TEL: + 91 22-61453300 / FAX: + 91 22-66914499 CIN: : L25209DD1992PLC009784 Website: www.tokyoplastint.in Extract of Standalone Audited Financial Results for the Quarter and Year ended March 31, 2024

				(Rs. In lacs)
	STANDALONE			
Particulars	Quarter Ended		Year Ended	
	31.03.2024	31.03.2023	31.03.2024	31.03.2023
	Audited	Audited	Audited	Audited
Total income from operations	1696.25	1966.99	6636.61	7552.81
Net Profit for the period (before Tax, Exceptional				
and/or Extraordinary items)	6.98	119.37	128.36	76.76
Net Profit for the period before tax (after				
Exceptional and/or Extraordinary Items)	6.98	61.43	128.36	18.82
Net Profit for the period after tax (after				
Exceptional and/or Extraordinary items)	(6.18)	61.43	100.28	(12.45)
Equity Share Capital (FV of Rs. 10/- per share)	950.14	950.14	950.14	950.14
Reserves (excluding Revaluation Reserve as				
shown in the Balance Sheet)	-	-	5064.69	4938.22
Earnings Per Share				
Basic:	(0.07)	(0.32)	1.06	(0.13)
Diluted:	(0.07)	(0.32)	1.06	(0.13)

Notes: 1. The above results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meeting held on Tuesday, 28th May, 2024. 2. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI

ઝઘડિયાની સેવારૂરલ હોસ્પિટલમાં ખોદકામ દરમિયાન ગેસ લીકેજથી દોડધામ મચી

હોસ્પિટલમાં ગેસ લિકેજ થી કોટ ઇ મોલ દુર્ઘટનાની હજુતો શાહી સુકાઈ નથી ત્યાં આ ઘટનાએ અફરાતફરી મચાવી દીધી હતી જોકે સદનસીબે અકસ્માતના પગલે કોઈ જાનહાની નોંધાઈ નથી અને ગણતરીની પળોમાં સ્થિતિ પર દરમિયાન જેસીબીથી ખોદકામ <mark>સુરત શહેરમાં ચોર્યાસી</mark> કાબુ મેળવી લેવાયો હતો.

જેસીબીથી ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની લાઇન તુટી જતા ગેસ લિકેજ તમામ દર્દીઓ ને સુરક્ષિત પુનઃ <mark>લોજીસ્ટીક પ્રા.લી નામની તેઓએ પંકજ મીશ્રાનો કોન્ટેક</mark> થયો હતો. હોસ્પીટલના સ્ટાફ

દ્વારા દર્દીઓના વોર્ડ ખાલી <mark>રેસીડેન્સીમાં આવેલી કૈરવ</mark> ઝઘડિયા ની સેવા રૂરલ કરાવી દર્દીઓને હોસ્પીટલ <mark>લોજીસ્ટીક પ્રા.લી ટ્રાન્સપોર્ટના</mark> બહાર કઢાયા હતા. થોડીવાર <mark>માલીક પાસેથી મુંબઈ પોર્ટ</mark> દોડધામ મચી ગઈ હતી. રાજ- માટે આખા સંકુલમાં અફરા- <mark>ખાતે</mark> તફરી નો માહોલ છવાયો હતો. <mark>મોકલવવાના બહાને રૂપિયા</mark> હોસ્પિટલ મેનેજમેન્ટ અને ગેસ <mark>૫.૭૨ લાખ પડાવી ગાડીઓ</mark> કંપનીની સમયસુચકતાના મુંબઈ પોર્ટ ખાતે નહી મોકલી કારણે કોઇ જાનહાનિ નોંધાઈ <mark>છેતરપિંડી કરવામાં આવી છે.</mark> નથી.

હોસ્પીટલમાં લવાયા છે.

💋 बैंक ऑफ़ बड़ौदा Bank of Baroda હોર્નિમન સર્કલ શાખા ૧૦/૧૨, મુંબઇ સમાચાર માર્ગ

કોર્ટ, મંબઇ-૪૦૦૦૦૧ સુધારો ુપા કરીને આ અખબારમાં **૨૫.૦૪.૨૦૨**૧

. 11 રોજ લેણદાર **મેસર્સ હિદાન ઇન્ડસ્ટ્રીયલ** धटना એન્ટરપ્રાઇઝીસ (ભાગીદાર : અશોક્કમાર જેન અને શ્રી અભિષેક અશોક્કુમાર જેન) ના સંદર્ભમાં પ્રકાશિત થચેલ સ્થાવર મિલકતો માટેની સરફેસી **इण्डानी नोटीसनो संદर्ભ લો,** 🕈 ताट्डाલिः ઝસરથી પાછી ખેંચી લેવામાં આવી છે. તારીખ : ૩૦.૦૫.૨૦૨૪

અધિકૃત અધિકારી બેંક ઓફ બરોડા, હોર્નિમન સર્કલ

પટકાયેલાં આધેડનું મોત હતી. જેના કારણે રીક્ષામાં શહીદ અબ્દુલ અઝીઝ શેખ પાંડેસરા બાટલી બોય પાસે બનેલી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, **તા. ૨૯** : પાંડેસરા બાટલી બોય સર્કલથી સિદ્ધાર્થ નગર નહેર તરફ જતા રોડ ઉપર ુ<mark>લ્લી/-</mark> એક ઓટો રીક્ષા ચાલકે ઓટોરિક્ષા પુર ઝડપે હંકારી

સવાર આધેડ રીક્ષામાંથી નીચે પડી જતા તેને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું

ભેસ્તાન પાટિયા વિસ્તારમાં ભીંડી બજાર પાસે શાહીરાનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા ૩૦ વર્ષિય અબ્દુલ

ગતરોજ જીજે.પ.બી ડબલ્યુ પ૨૪૨ નંબ૨ના ઓટો રીક્ષા ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના પિતા અબ્દુલ અઝીઝ અબ્દુલ લતીફ ઓટો રીક્ષામાં બેસી કામ અર્થે જવા માટે નીકળ્યા હતા.ત્યારે ઓટો રીક્ષા ચાલકે

પાંડેસરા બાટલી બોય

સર્કલથા સિદ્ધાર્થ નગર નહેર તથા શરીરના ભાગે ગંભીર હાથ ઘરી છે.

ઈજા થઈ હતી.જેના કાર તરફ જતા રોડ ઉપર ગુજરાત તેનું ઘટના સ્થળે જ કરુણ ગેસ સીએનજી પમ્પ ની સામે મોત નિપજ્યું હતું. જેથી ઓટો રીક્ષા પુરપાટ ઝડપે આખરે મૃતક આધેડના પુત્ર ચલાવી હતી. જેના કારણે અબ્દુલ શહીદની ફરિયાદના અબ્દુલ સહિદના પિતા આધારે પાંડેસરા પોલીસે અબ્દુલ અજીજ ઓટો રીક્ષા રીક્ષા ચાલક સામે ફેટલ માંથી નીચે પટકાયા હતા. અકસ્માત નો ગુનો દાખલ જેના કારણે તેઓને માથામાં કરી કાયદેસરની કાર્યવાહી

ઇચ્છાપોરના ટ્રાન્સપોર્ટર સાથે રૂા. ૫.૭૨ લાખની છેતરપિંડી મુંબઇ ગુજરાત ગેસની લાઇન તુટી જતા ગેસ લિકેજ થયો પાટે ખાતે ટ્રકો મોકલવાના એડવાન્સ રૂપિયા મેળવી ટ્રકો મોકલી નહી

(પ્રતિનિધિ દ્વારા) તરીકે નોકરી કરે છે. સુરત, તા. ૨૯ : ઈચ્છાપોર બસ સ્ટોપ પાસે રાધે

१६ હોસ્પિટલમાં મૂળ હરિયાણાના ભીવાનીના નિર્માણકાર્યના નવા બાંધકામ <mark>ધારેડુ ગામના વતની અને હાલ</mark> દરમિયાન ઘટના બની <mark>તાલુકાના ઈચ્છાપોર ગામ રાધે</mark> હતી.ગેસ પુરવઠો બંધ કરી <mark>રેસીડેન્સીમાં રહેતા ૪૬ વર્ષિય</mark>

સુરેન્દ્ર શર્મા અવાર નવાર માલ સામાન ટ્રાન્સપોર્ટ કરવાનો હોવાથી અલગ અલગ જગ્યાએ ટ્રાન્સપોર્ટ વાળાની ટ્રક મંગાવી ટ્રાન્સપોર્ટ કરતા હોય છે.વીસ દિવસ પહેલા મગદલ્લા ચોકડી ખાતે આવેલી કે.પી.ગ્રુપ દ્વારા તેમની કંપનીનો માલ સામાન મુંબઈ પોર્ટ ખાતેથી ભરુચ ખાતે મોકલવાનો હતો. આ માલ મુંબઈ પોર્ટથી ભરુચ મોકલવા માટે ૧૬ ગાડીઓની જરૂર હોવાથી સુરેન્દ્ર શર્માએ તેમની કંપનીમાં કામ કરતા અર્જુન સમારકામ કરાયું ચેક સાથે સુરેન્દ્ર ચંદ્રભાન શર્મા કૈરવ માંગીલાલને વાત કરતા ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર નંબર આપ્યો હતો. સુરેન્દ્રએ કરતા ચોકી ઉઠ્યો હતો અને

પંકજ મીશ્રા સાથે વાત કરતા પંકજ મીશ્રાને ફોન કરતા તેશે ૨૧ જુલાઈના રોજ સુપર મોબાઈલ બંધ આવતો હતો. ઈન્ડીયા રોડ વેઈઝની ૧૬ ગાડીઓ મુંબઈ પોર્ટ ખાતે લાગી જશે કહી ગાડીના ભાડા પેટે સુપર ઈન્ડિયા રોડવેઈઝના નેશનલ બેન્કના ખાતામાં કુલ રૂપિયા ૫,૭૨,૦૦૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા.આ દરમ્યાન બીજા દિવસે અર્જુન માંગીલાલ ઉપર ગંગોત્રી લોજીસ્ટીકના કમલ ચૌધરી એ ફોન કરી ગાડીઓ મુંબઈ પોર્ટ ખાતે મોકલી આપી છે. પરંતુ તેનુ પેમેન્ટ મળ્યુ નથી હોવાની વાત કરી હતી. જે અંગે અર્જુનએ સુરેન્દ્ર શર્માને વાત

સુરેન્દ્રએ ૨૩ એપ્રિલના રોજ १४ ગાડીના રૂપિયા ૫,૩૯,૦૦૦ લોજીસ્ટીકના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. ત્યારબાદ સુરેન્દ્ર શર્માએ મુંબઈ પોર્ટ ખાતે ૧૬ ગાડીઓ નહી મોકલી ભાડા પેટે રૂપિયા પ.૭૨ લાખ પડાવી છેતરપિંડી કરનાર કરી હતી.આ અંગે સુરેન્દ્રએ પંકજ ઈશ્વરચંદ મીશ્રા (રહે, બુલાવા બસ્તી ગામ, જાનપુર યુપી તથા આર્યન-૧ હાઉસ નગર બદલાપુર ઈસ્ટ થાણે મુંબઈ) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ઓનલાઇન પાર્ટટાઇમ જોબના ચક્કરમાં ચુવક છેતરાયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. ૨૯: આઈડી ઉપરથી તેમને ભેજાબાજે મગદલ્લા ખાતે આવેલ કંપનીમાં લેબ ટેક્રીશીયન તરીકે નોકરી કરતા અડાજણ વિસ્તારમા ૩૦ વર્ષીય યુવક ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબના ચક્કરમાં રૂપિયા ૧.૨૨ લાખ ગુમાવ્યા હતા. ટેલીગ્રામ મારફતે સંપર્ક કરનાર ભેજાબાજે ભેજાબાજે વોટ્સએપ વોટ્સએપ ચેનલો ફોલો અને લાઈક કરવા માટે ટાસ્ક આપી તે પુરા કરવાના બદલામાં નાણાં આપવાની લાલચ આપી ટુકડે ટુકડે કરી ઓનલાઈન ટ્રાન્સફર કરી પડાવ્યા હતા. અડાજણ વન ભવનની બાજુમાં ડી-માર્ટ પાસે અશ્વમેઘ એપાર્ટમેન્ટમાં રહેતા ૩૦ વર્ષિય વૈભવકુમાર રમેશભાઈપટેલ મગદલ્લા ખાતે આવેલ જી.આઈ.એ પ્રા.લી કંપનીમાં લેબ ટેક્રીશયન તરીકે નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરે છે. ગત તા ૨૯ માર્ચના રોજ તેઓ નોકરી ઉપર હતા તે વખતે સોશ્યલ મીડીયા ટેલીગ્રામની રાખાસિંહ નામની

ભેજાબાજે પાર્ટ પાર્ટ ટાઈમ નોકરીની જરૂર છે હોવાનો મેસેજ કર્યો હતો. વૈભવકુમારે નોકરી માટે હા પાડતા ભેજાબાજે વોટ્સએપ ચેનલો ફોલો અને લાઈક કરી તેના સ્ક્રીન શોર્ટ ટેલીગ્રામ આઈડી ઉપર મોકલી આપવાથી પૈસા મળશે હોવાની વાત કરી હતી અને શરુઆતમાં ૧૨૦ રૂપિયા આપી વિશ્વાસમાં લીધો હતો.ત્યારબાદ ભેજાબાજે વૈભવકુમારને તેમની કંપની સોશ્યલ મીડીયા પર મરચન્ટના ટાસ્ક પ્રમોટ કરીએ છે અને તેને ત્રણ મીનીટમાં એક ટાસ્ક પુરો કરવાનો રહેસે તે સેલેરી રીવોર્ડ મળસે અને હું પોતે તેમાં મેનેજર છુ કહી વિશ્વાસ લઈ અલગ અલગ ટાસ્ક પુરા કરવાના બહાને વૈભવકુમાર પાસેથી ગત તા ૩૦ માર્ચથી ૫ મે સુધીમાં ટુકડે ટુકડે કરી ખાતામાંથી ૧,૨૨,૦૦૦ઓનલાઈન ટ્રાન્સફર

તમામ સ્કૂલો માટે એક પરિપત્ર

જાહેર કરવામા આવ્યો છે. આ

પરિપત્રમાં ફાયર સેફ્ટી ઉપરાંત

જનસેવા કેન્દ્રો ઉપર સવારે છ વાગ્યાથી લોકોની લાંબી લાઇન

: બાળકોના એડમિશન અને ગુજરાત સરકારની સ્કોલરશિપ યોજના નમો લક્ષ્મી માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પુરાવા વેબસાઈટ પર ઓનલાઈન સબમીટ કરાવાના કરાયેલા આદેશ બાદ વાલીઓની દોડધામ વધી ગઈ છે. આવકના દાખલા માટે શહેરના જનસેવા કેન્દ્રો પર ધસારો વધ્યો છે. સવારે ૬ વાગ્યાથી વાલીઓ જન સેવા કેન્દ્રો પર

મોકલાવી પોતાનું કામ બારોબાર કરાવી રહયા છે. કેટલાંક એજન્ટો તો વાલીઓની મજબૂરીનો લાભ ઉઠાવી વધુ ચાર્જ વસૂલતા હોવાની બૂમ ઉઠી છે. આજે સવારે સુરતના જન સેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી લાઈન લાગી હતી. સવારે ૬ વાગ્યાથી વાલીઓ લાઈનમાં ઉભા હતા, પરંતુ બપોર સુધી જન સેવા કેન્દ્ર ખુલ્યું નહોતું. વળી, જન સેવા કેન્દ્રમાંથી માત્ર ૨૦૦ જ ટોકન મળતા હતા. બીજી પહોંચી ગયા હતા. તેમ છતાં તેઓનો તરફ દલાલો, એજન્ટો થેલો ભરી નંબર લાગી રહયો નથી. જન સેવા ડોક્યુમેન્ટ લઈને જન સેવા કેન્દ્ર પાસે કેન્દ્રો તરફથી ૨૦૦ જ ટોકન ફરતા દેખાયા હતા. દલાલોના કામ આપવામાં આવતા હોવાથી વાલીઓને બારોબાર થતા હોવાથી લોકો રોષે ધક્કો થઈ રહયો છે. બીજી તરફ ભરાયા હતા. તંત્રની ઢીલી કામગીરીથી કુમાર કાનાણીએ એક દિવસ ઝોનની વિદ્યાર્થીઓ અને વાલી ઓની લાંબી એજન્ટો પાછલા બારણે ડોક્ચુમેન્ટ લોકો નારાજ થયા હતા.વરાછાના મુલાકાત લીધી ત્યારે કામ બરોબર થયું કતારો જોવા મળે છે.

ધારાસભ્ય કુમાર કાનાણીએ ગઈ તા. ૧૫મી મે ને બુધવારના દિવસે સુરત જિલ્લા કલેક્ટરને એક પત્ર લખી વિદ્યાર્થી અને વાલીઓને આવકના દાખલા મેળવવામાં પડતી તકલીફનું નિવારણ લાવવા અપીલ કરી હતી. કલેક્ટરે પત્રને ધ્યાને લીધો કે નહીં તે તો ખબર નહીં પરંતુ લોકોની સમસ્યા દૂર કરવા ધારાસભ્ય કુમાર કાનાણી જાતે જ બીજા દિવસે વરાછાના નાગરિક સવિધા કેન્દ્રો પર પહોંચી ગયા હતા અને કર્મચારી-અધિકારીઓને લોકો માટે સારું કામ કરવા સલાહ આપી હતી.જોકે, શેઠની પર હજી પણ આવક સહિતના દાખલા શિખામણ ઝાંપે જેવી હાલત થઈ છે. લેવા માટે સૂર્યોદય પહેલાં જ

પરંતુ હવે ફરી એકવાર સ્થિતિબગડી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ આવકના દાખલા મેળવવા માટે જન સેવા કેન્દ્રોના ધક્કાં ખાઈ રહયા છે.આ સ્થિતિમાં કેટલાક દલાલો અને એજન્ટો દ્વારા એક હજારથી ૧૫૦૦ રૂપિયા લઈને બારોબાર દાખલાઓ કાઢી આપતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જેને પગલે સવારે છ વાગ્યાથી લાઈનમાં ઉભા રહેનારા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વેકેશન પરૂં થવાને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે શહેરના વિવિધ જન સેવા કેન્દ્રો

ગોપીપુરા સ્થિત સમગ્ર શિક્ષા અભિયાન કચેરીનો સ્ટ્રકચરલ રિપોર્ટ નેગેટિવ છતાં ઓફિસ કાર્યરત

દિવા તળે અંધારૂ : કેટલીક સરકારી ઇમારતો જ સેફ નથી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. ૨૯ : સુરત સહિત ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી ઉભી કરવા તથા વિદ્યાર્થીઓને જર્જરિત વર્ગખંડમાં ન ખસેડવા તથા શાળાના મકાનની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેની તાકીદ કરતો પત્ર સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જોકે, સુરત સહિત ગુજરાતની તમામ શાળાઓને સ્ટેબિલિટીની

બિલ્ડિંગની

નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ

ધરી છે. શહેરની સોલા,

સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ છે. વર્ષ ૨૦૨૦માં સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેમ છતાં સમગ્ર શિક્ષા અભિયાન ઓફિસ સાથે તેના બાધકામને લગતી ઓફિસ પણ આ જ બિલ્ડીંગમાં હાલ પણ કાર્યરત છે. રાજકોટની દુર્ઘટના બાદ સુરત સહિત ગુજરાતના તંત્ર ઉંઘમાંથી સફાળું જાગ્યું છે અને આવા બનાવ નહી બને તે માટેની સુચનાઓ શરુ કરી દીધી છે. આ ઘટના શિક્ષા અભિયાનની સુરતની પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ ઓફિસ જે બિલ્ડીંગમાં ચાલે છે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા સ્ટ્રકચર સુરત પાલિકા સહિત રાજ્યની

રાજ્યમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ

સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગે પણ સૂચના લખવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે, શાળામાં જર્જરિત રૂમ જાહેર થયેલ હોય અથવા સામાન્ય રીતે ભયજનક લાગતા હોય તેવા વર્ગખંડમાં બાળકોને બેસાડવા નહિ. આ ઉપરાંત અન્ય તકેદારી રાખવા માટે પણ સૂચના જાહેર કરવામા આવી છે.શાળામાં એક પણ શિખામણ આપનાર સમગ્ર બાદ ગુજરાત શાળા શિક્ષણ વર્ગખંડ જર્જરિત હોય તો વિદ્યાર્થીઓને નહી બેસાડવાનો પરિપત્ર જાહેર કરનાર સમગ્ર શિક્ષા અભિયાનની સુરત ખાતેની જે કચેરી છે તે કચેરીની બિલ્ડીંગ જ આખેઆખી જર્જરિત છે. વર્ષ ૨૦૨૦ માં એપ્રિલ મહિનામાં ગોપીપુરા ખાતેની આ બિલ્ડીંગની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ જ બિલ્ડીંગમાં ૧૩૦ નંબરની એક શાળા ચાલતી હતી. આ શાળાના રિપોર્ટ નેગેટિવ આવતા આ શાળાને નજીકમાં આવેલ અન્ય શાળા સાથે વર્ષ ૨૦૨૦ ના ઓગસ્ટ મહિનામાં મર્જ કરી દેવામાં આવી હતી. ૨૦૨૦ માં જે બિલ્ડીંગનો સ્ટ્રકચર સ્ટેબિલીટી રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તેમાં જ સમગ્ર શિક્ષા અભિયાનની કચેરી છે અને થોડા સમય પહેલાં તો આ બિલ્ડીંગમાં સમગ્ર શિક્ષા અભિયાનના બાંધકામ શાખા પણ શિફ્ટ કરવામાં આવી છે. આમ લોકો પાસે નિયમોનું પાલન કરાવતું તંત્ર જ સરકારના નિયમોનું પાલન કરતા નથી અને લોકો નિયમોનો અમલ કરે તેવો આગ્રહ રાખે છે.

શહેરની તમામ શાળાઓમાં ચેકીંગ શરૂ કરવાનું અલ્ટીમેટમ આપતાં ડીઇઓ

વેકેશન હોવા છતાં તમામ શાળા ચાલુ રાખવા સુચના

તા. ૨૯ : રાજકોટ હોનારત મેનેજમેન્ટ સંદર્ભેની તપાસ વેકેશનનો માહોલ હોવા છતાં બાદ સુરત સહિત સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ફાયર સેફટી રોજ જિલ્લા કલેકટર કચેરી આવ્યું હતું.જેને પગલે શાળાની ઘોળીને પી જનારાઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહીના ભાગરૂપે સરકાર સહિત સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા એકશન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે. આ તબક્કે સુરત શહેર ૭-જિલ્લામાં આવેલી તમામ -શાળાઓ વેકેશનના માહોલ તમામ વિભાગો વચ્ચે સંકલન વચ્ચે પણ ખુલ્લી રાખવા માટે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિભાગની એનઓસી મુદ્દે આદેશ ફરમાવવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ ધરવા અંગેનો નિર્ણય લેવામાં

હાથ ધરવામાં આવનાર કમિશનર અને પોલીસ કમિશનર સહિત ડીઈઓ, ડીજીવીસીએલ, જીઆઈડીસી સહિતના વિભાગના ઉચ્ચાધિકારીઓની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાધીને ફાયર સહિતના તળિયાઝાટક તપાસ હાથ

(પ્રતિનિધિ દ્વારા) સુરત, શાળાઓ માંડિઝાસ્ટર આવ્યો હતો. બેઠક દરમિયાન પણ શાળાઓ ખુલ્લી રાખવા હોવાનું જાણવા મળ્યું છે. ગત અંગે ડીઈઓને જણાવવામાં નીતિ-નિયમોને ખાતે કલેકટર, મ્યુનિસિપલ ઈમારતમાં ફાયર સેફટી સહિતની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ તે અંગે ચકાસણી કરવામાં ટીમને સરળતા રહે. જેને પગલે આજરોજ ડીઈઓ દ્વારા તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્ય અને સંચાલકોને શાળાઓ ખુલ્લી રાખવાની સૂચના આપવામાં આવી છે અને જેનું ચુસ્તપણે પાલન કરવા અંગે પણ નિર્દેશ

આપવામાં આવ્યો છે. નામ બદલેલ છે.

નટવરલાલ રાખેલ છે. જેની સર્વે નોંધ લેવી. લિ.: અધિકારી સંજયકુમાર

સરનામું : એ- ૧૦૪, ગ્રીન એન્કલેવ, ગુજરાત ગેસ સર્કલ,

સમગ્ર રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા વડાઓ સહિતના અધિકારીઓની ઊંઘ ઊડી ગઈ છે. સમગ્ર તંત્રને સરકાર દ્વારા રાજ્યમાં ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવાની સખત તાકીદ કરવામાં આવી છે અને તેને આધારે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તેના આદેશના પગલે અમદાવાદમાં પણ તંત્ર કામે લાગી ગયું હતું . દરમિયાનમાં શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં બે અને આનંદનગર તથા નિકોલના એક એક સંચાલકો સામે ગેરકાયદે ગેમ ઝોન ચલાવવાના આરોપ સર ગુના નોંધવામાં આવ્યા છે. શહેરના ચાર ગેમ ઝોનના માલિક વિરુદ્ધ પોલીસે ગુનાઓ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

રાજકોટ અગ્નિકાંડને પગલે

સોલા, આનંદનગર અને નિકોલ પોલીસે તેમની હદમાં ચાલતા ગેરકાયદે ગેમ ઝોનના માલિકો વિરુદ્ધ કોર્પોરેશનના અભિપ્રાય બાદ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ગોતામાં આવેલા ફન ગ્રીટો, જોધપુર સીમા હોલ નજીક ફાયર એનઓસી તથા પોલીસ પરવાનગી વિના ચાલી રહેલા ગેમ ઝોનને સીલ મારવામાં આવ્યું છે. તેના સંચાલક વિજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. બીજીતરફ નિકોલના પ્લેટિનિયમ પ્લાઝામાં આવેલા ફન કેમ્પસ ગેમઝોનમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પણ ફાયર એન.ઓ.સી તથા પોલીસ પરવાનગી ઉપરાંત હવા-ઉજાસ માટેની બારીઓ ઉપલબ્ધ નહીં હોવાના કારણોસર કોર્પોરેશન દ્વારા ગેમ ઝોનને સીલ કરી દેવાયું છે. સાથે જ નિકોલ પોલીસ સ્ટેશને ગેમ ઝોનના સંચાલક વિરુદ્ધ ગુનો

આનંદનગર તથા નિકોલ પોલીસે તેમના વિસ્તારમાં ચાલતા ગેરકાયદે ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ગોતામાં આવેલા ફન ગ્રીટોમાં પણ સરકારી નિયમોને નેવે મૂકીને ગેમ ઝોન ચલાવવામાં આવતું હતું, જોધપુરમાં સીમા હોલ નજીક આવેલા ગેમ ઝોનમાં ફાયર એન.ઓ.સી,પોલીસ મંજૂરી તથા અન્ય બીજી જરૂરી પરવાનગી મેળવી ન હતી. તેવી જ રીતે નિકોલમાં પ્લેટીનીયમ પ્લાઝામાં ચાલતા ગેમ ઝોનમાં પણ કોઈપણ જાતની પરવાનગી વિના ગેમ ઝોન બેફામ ચલાવવામાં આવતું હોવાથી નિકોલ પોલીસે ગેમ ઝોનના માલિક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટની ્ઇ ગેમઝોનની ગોજારી દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી

नाभ अहलेल छे

મારૂ જુનુ નામ

જીતેન નટવરલાલ

પટેલ

હતું, જે બદલીને નવું નામ

શ્વવન નડવરભાઈ

પટેલ

રાખેલ છે, જેની સર્વોએ નોંધ લેવી.

सही/- अतेन

નટવરભાઈ પટેલ

સરનામુ : ૧૨૮-૨,

પંચ ફળીચુ, ડભોલી,

सुरत सीटी, सुरत-३६५००४

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગના અધિકારીઓની બેઠકમાં આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન થાય નહીં તેની તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં આવી જગ્યાઓ પર ખાસ ચેકિંગ કરવા સહિત અસરકારક કડક પગલાં સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કમિશનર તથા તમામ જિલ્લા પોલીસ વડાઓને ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા અને જે ગેમ ઝોનનું ફાયર ર્દ્રંઝ ન હોય તથા લાઈસન્સ ન હોય તેમજ નિયમ મુજબની કાર્યવાહી કરી ન હોય તેના માલિકો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવા આદેશ

આપવામાં આવ્યા છે. નામ બદલેલ છે.

મારું જૂનું નામ **શ્રેયશકરણ પિયુષભાઈ વ્યાસ** હતું જે નામ બદલીને નવું નામ શ્રેયશકરણ પિયુષકરણ વ્યાસ રાખેલ છે. જેની સર્વે નોંધ લેવી. લિ.: શ્રેયશકરણ પિયુષકરણ વ્યાસ **સરનામું** : ગૌરી - શ્યામ, એસ બી પી પી બેક પાસે, ભોળા નગર, ફર્સ્ટ ગેટ અતુલ, વલસાડ જિલ્લો, ગુજરાત- ૩૯૬૦૨૦

નામ બદલેલ છે.

મારું જૂનું નામ વાવિયા જીતુભાઇ **બાબુભાઇ** હતું જે નામ બદલીને નવું નામ જીતેન્દ્રભાઇ બાબુભાઇ વાવિયા રાખેલ છે. જેની સર્વે નોંધ લેવી. લિ.: જીતેન્દ્રભાઇ બાબુભાઇ વાવિયા **સરનામું :** એફ-૨૦૨, સિલ્વર મેગઝીમા, વીઆઈપી સર્કલ પાસે, ઉતરાણ, સુરત, ગુજરાત- ૩૯૪૧૦૫

UG ના પ્રવેશ માટે ૨ જૂન સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

અમદાવાદ, તા.૨૯ રાજ્યની ૧૫ સરકારી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખી, બી.એ., બી.કોમ., બી.એસસી., બી.બી.એ., બી.સી.એ. સહિતના પ્રોગ્રામ અને અન્ય પ્રોગ્રામમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ય્ઝછજી ગુજરાત કોમન એડમિશન સર્વિસિસપોર્ટલ મારફત પ્રવેશ અંગે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પહેલી એપ્રિલથી

શરૂ કરેલ હતી. વેકેશન કે અન્ય કારણોસર ૨૮ મે ૨૦૨૪ને છેલ્લી તારીખ સુધીમાં ૪ લાખ ૩૯ હજાર ૮૬૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવેલ છે અને તે પૈકી ૨ લાખ ૬૩ હજાર ૧૧૫ વિદ્યાર્થીઓએ ફી ભરેલ છે અને હજુ પણ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન/ફી ભરી શક્યા નથી. આ અંગે વિવિધ યુનિવર્સિટીઓ, કોલેજો અને વિદ્યાર્થીઓની રજૂઆત શિક્ષણ વિભાગને મળેલ હતી.

મારું જૂનું નામ **અધિકારી સંજય** હતું જે નામ બદલીને નવું નામ અધિકારી સંજયકુમાર

નટવરલાલ

અડાજણ, સુરત.

નામ બદલેલ છે.

મારું જૂનું નામ **ખેની અભી દિનેશકુમાર** હતું જે નામ બદલીને નવું નામ ખેની અભી દિનેશભાઈ રાખેલ છે. જેની સર્વે નોંધ લેવી. લિ.ઃ ખેની અભી દિનેશભાઈ **સરનામું** : એ-૨૧૦૩,

ધ મરીના, વી.આઇ.પી સકેલ

પાસે, ઉત્રાણ, સુરત.

भा३ शुनु नाभ ભાચાણી જગદીશકુમાર જેરાજભા**ઈ** हतुं ते अहसीने નવું નામ જગદીશભાઈ

નામ બદલેલ છે

જેરાજભાઈ ભાચાણી રાખેલ છે. જેની સર્વોએ નોંધ લેવી. લિ. જગદીશભાઈ

જેરાજભાઈ ભાચાણી સરનામું : ૨૪, અખંડઆનંદ પાર્ક સોસાયટી, આંબાતલાવડી, સુરત સીટી, સુરત, ગુજરાત – ૩૯૫૦૦૪

CMYK +